

Fantastic 40

**40 HEART HEALTHY
RECIPES DOCTORS
CHOOSE TO
STAY HEALTHY**

Do you know?

Up to 80% of premature heart disease can be prevented through your life habits, such as eating a healthy diet.



Index

સવારનો નાસ્તો



| | |
|--|----|
| ઉત્તર ભારત . | |
| ઓટસ અને દ્રધીની રોટલી . | 02 |
| બેસન અને પાલકના પુડ્લા . | 03 |
| પાલક ઓમેલેટ . | 03 |
| દક્ષિણ ભારત . | |
| વેજ ઓટસ ઉપમા . | 04 |
| દુંગળી અને જુવારની રોટલી . | 04 |
| બ્રાઉન ચોખાના ઢોસા સાથે નાળિયેરની ચટણી . | 05 |
| પૂર્વ ભારત . | |
| બકવીટ (કુદુ) પેનકેક . | 05 |
| દાલ પીઠા . | 06 |
| ઓટસ-ફળનો દલિયા . | 06 |
| પશ્ચિમ ભારત . | |
| બાજરીના પુડ્લા . | 07 |
| થાલીપીઠ . | 07 |
| વેજુટેબલ પોથા . | 08 |

બપોરનું ભોજન



| | |
|--|----|
| ઉત્તર ભારત . | |
| રાગીની રોટલી . | 09 |
| વેજ ડિવનોઓ અને દહી . | 10 |
| મગની દાળના પુડ્લા ચીલા અને કુદીનાની ચટણી . | 10 |
| દક્ષિણ ભારત . | |
| રાગી ઈડલી અને સાંભાર . | 11 |
| લેમન રાઇસ પુલાવ . | 11 |
| જુવારના ઢોસા અને આદુ લસણની ચટણી . | 12 |
| પૂર્વ ભારત . | |
| યોલર (ચણા) દાળ સાથે બ્રાઉન ભાત . | 12 |
| રોટલી સાથે કાળા ચણાની ધુગની . | 13 |
| દાલમા સાથે રાગી રોટી . | 13 |
| પશ્ચિમ ભારત . | |
| બાજરીની ખીચડી . | 14 |
| બેસન કઢી . | 14 |
| શાકભાજુ સ્ટ્ર્યુ . | 15 |

સૂપ



| | |
|-------------------------|----|
| ટામેટાનો સૂપ . | 16 |
| મિક્સ વેજુટેબલ સૂપ . | 17 |
| મસૂર અને ટામેટાનો સૂપ . | 17 |
| લીંબુ ક્રોથમીરનો સૂપ . | 18 |

રાત્રિભોજન



| | |
|---------------------|----|
| ઉત્તર ભારત . | |
| વેજુટેબલ ખીચડી . | 19 |
| દલિયા ખીચડી . | 20 |
| પેન ગ્રીલ ચિકન . | 20 |

| | |
|----------------------|----|
| દક્ષિણ ભારત . | |
| વેજુટેબલ સાંભાર . | 21 |
| કેરળ ડિશ કરી . | 21 |
| સોચા ઉત્તાપમ . | 22 |

| | |
|------------------------------|----|
| પૂર્વ ભારત . | |
| બ્રાઉન ભાત સાથે સુક્તો . | 22 |
| માયેર ઝોલ (બંગાળી ડિશ કરી) . | 23 |
| મિક્સ વેજુટેબલ કરી . | 23 |

| | |
|--------------------------|----|
| પશ્ચિમ ભારત . | |
| ઉસળ સાથે જુવારની રોટલી . | 24 |
| સાદા વરણ ભાત . | 24 |
| એગ વિન્ડાલુ . | 25 |

| | |
|---------------------------|----|
| અમારા ડાયેટિશિયનની સલાહ . | 25 |
|---------------------------|----|



ભારતીયોની પોષણાની જરૂરિયાતો

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ન્યુડ્રિશનની માર્ગદર્શિકા મુજબ, ભારતીય પુખ્ત વચ્ચના લોકો માટે દૈનિક કેલરીની જરૂરિયાતો નીચે મુજબ છે:¹



બેઠાડું જીવનશૈલી ધરાવતા પુરુષ
માટે દરરોજ 2110 કેલરી



મધ્યમ પ્રવૃત્તિ ધરાવતા પુરુષ માટે
દરરોજ 2710 કેલરી



ભારે પ્રવૃત્તિ ધરાવતા પુરુષ માટે
દરરોજ 3470 કેલરી



બેઠાડું જીવનશૈલી ધરાવતી સ્ત્રી માટે
દરરોજ 1660 કેલરી



મધ્યમ પ્રવૃત્તિ ધરાવતી સ્ત્રી માટે
દરરોજ 2130 કેલરી



ભારે પ્રવૃત્તિ ધરાવતી સ્ત્રી માટે
દરરોજ 2720 કેલરી

સેન્ટર્સ ફોર ડિસીઝ કંપ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ, તમે સ્વસ્થ જીવનશૈલી અપનાવીને તમારા હદય રોગના જોખમને ઘટાડી શકો છો. સ્વસ્થ જીવનશૈલીમાં સ્વસ્થ ખોરાક લેવો, સ્વસ્થ વજન જાળવી રાખવું અને નિયમિત શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ થાય છે.²

પોષણશાસ્ત્રીઓના મતે દરેક ભોજનમાં સરેરાશ દૈનિક સેવનને નીચે પ્રમાણે વિલાંજિત કરવું જોઈએ:



સવારનો નાસ્તો
300 થી 400
કેલરી

બપોરનું ભોજન
500 થી 700
કેલરી

રાત્રિભોજન
500 થી 700
કેલરી

સાંજનો નાસ્તો
200 કેલરી કરતાં
વધુ નહીં

References: 1. https://www.nin.res.in/RDA_short_Report_2020.html.
2. <https://globalnews.ca/news/3615212/this-is-what-your-breakfast-lunch-and-dinner-calories-actually-look-like/>

સવારનો નાસ્તો

- દિવસનું પ્રથમ ભોજન
- શરીરને એનજી અને પોષક તત્વો પૂરા પાડે છે
- વજન નિયંત્રણમાં ખરેખર મદદ કરી શકે છે
- મગજની શક્તિ વધારે છે
- રોગોનું જોખમ ઘટાડી શકે છે



 ઉત્તર ભારતની સવારના નાસ્તાની કેટલીક લોકપ્રિય વાનગીઓનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે

ઓટસ અને દૂધીની રોટલી



બનાવવાની રીત

- 1 નાની દૂધી (ધિયા) છીંદી લો અને તેમાં 1 નાની ચમચી લીલા મરચાં, 1 કપ શેકેલા ઓટસ, 1 નાની ગીણી સમારેલી ઝંગળી, ધાણાજું, મીઠું અને $\frac{1}{2}$ કપ આખા ઘઉનો લોટ ઉમેરો.
- સારી રીતે મિક્સ કરો અને લોટ બાંધો અને 15 મિનિટ માટે બાજ પર રાખો.
- કણકનો એક નાનો બોલ લો અને તેની નાની રોટલી બનાવો. ગરમ તવા પર મૂકો અને ધીમી આંચ થવા દી અને બીજુ બાજ ગોલન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધો.
- ઉપર થીડું ધી મૂકો (વેકલ્પેક) અને રાયતા અથવા ચટણી સાથે પીરસો.

પોષણ મૂલ્ય (1 નંગા)

કેલરી: 65 કેલરી
ચરબી: 0.7 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ્સ : 13.1 ગ્રામ
પ્રોટીન્સ: 2.4 ગ્રામ

હદ્ય માટે સ્વાસ્થ્ય લાભો

- દૂધીમાં 'ડોલિન' ભરપૂર માત્રામાં હોય છે, જે મગજના કાર્યને સુધારે છે અને તણાવ તેમજ હતાશાને અટકાવે છે.
- સોડિયમ, પોટેશિયમ અને અન્ય આવશ્યક ખનિજોથી ભરપૂર છે જે લોહીના દબાણ ને નિયંત્રિત કરવામાં મદદ કરે છે

ਬੇਸਨ ਅਨੇ ਪਾਲਕਨਾ ਪੁਡਲਾ



ਪੋਖਰਾ ਮੂਲਕ (2 ਨਂਗਾ)

ਕੇਲਰੀ: 290.44 ਕੇਲਰੀ
ਚਰਬੀ: 11.25 ਗ੍ਰਾਮ
ਕਾਬੋਹਾਇਡ੍ਰੇਟਸ: 34.81 ਗ੍ਰਾਮ
ਪ੍ਰੋਟੀਨ: 12.48 ਗ੍ਰਾਮ

ਬਨਾਵਵਾਨੀ ਰੀਤ

- ਅਡਧੋ $\frac{1}{2}$ ਕਪ ਚਣਾਨੋ ਲੋਟ ਲੋ, ਤੇਮਾਂ $\frac{1}{2}$ ਕਪ ਚੋਖਾਨੋ ਲੋਟ ਉਮੇਰੋ ਅਨੇ ਮੀਠੂ, ਲਾਲ ਮਰਯੁ ਪਾਵਡਰ, ਛਣਦਰ, ਅਜਮੀ, ਜੁੜ੍ਹ, ਕਾਜਾ ਮਰੀ ਪਾਵਡਰ ਅਨੇ ਲੀਲਾ ਮਰਥਾਂ ਦੇਰੇਕ 1 ਨਾਨੀ ਚਮਚੀ ਉਮੇਰੋ.
- ਚਣਾਨਾ ਲੋਟਨਾ ਮਿਸ਼੍ਰਣਮਾਂ $\frac{1}{2}$ ਕਪ ਸਮਾਰੇਲੀ ਝੁਗਜੀ ਅਨੇ 2 ਕਪ ਸਮਾਰੇਲੀ ਪਾਲਕ ਉਮੇਰੋ.
- ਸਾਰੀ ਰੀਤੇ ਮਿਕਸ ਕਰੋ ਅਨੇ ਤੇ ਘਣ ਥਾਂਥ ਤਾਂ ਸੁਧੀ $\frac{1}{2}$ ਕਪ ਕੇ ਤੇਥੀ ਵਧੁ ਪਾਣੀ ਉਮੇਰੋ.
- ਤੇਨੇ 10-15 ਮਿਨਿਟ ਮਾਟੇ ਰਹੇਵਾ ਹੋ
- ਤਵਾਨੇ ਗਰਮ ਕਰੋ, ਜਾਡੀ ਗੋਗਾਕਾਰ ਪੁਡਲੇ ਬਨਾਵੋ, ਥੋੜੂ ਤੇਲ ਲਗਾਵੋ ਅਨੇ ਫਾਂਕੀ ਹੋ ਅਨੇ ਮਦਧਮ ਤਾਪ ਪਰ ਥਵਾ ਹੋ.
- ਫੇਰਵੀਨੇ ਬੀਜੂ ਬਾਜੂ ਥਵਾ ਹੋ.
- ਚਟਾਈ ਅਥਵਾ ਅਥਾਣਾਂ ਸਾਥੇ ਪੀਰਸੋ.

ਫਦਦ ਮਾਟੇ ਸ਼ਵਾਸਥਾ ਲਾਭੋ

- ਤੇਮਾਂ ਕੇਲਿਓਇਮ, ਆਈਨ, ਪੋਟੋਸ਼ਿਯਮ ਅਨੇ ਵਿਟਾਮਿਨ ਸੀ ਜੇਵਾ ਵਿਟਾਮਿਨਸ ਅਨੇ ਮਿਨਰਲਸ ਹੋਏ ਹੋ.
- ਤੇਮਾਂ ਗ੍ਰਾਵਟ ਅਨੇ ਅਗ੍ਰਾਵਟ ਬੰਨੇ ਫਾਇਬਰ ਹੋ, ਤੇਥੀ ਕੋਰੋਨਰੀ ਫਦਦ ਰੋਗ ਅਥਵਾ ਫਦਦ ਰੋਗ ਨੂੰ ਜੋਖਮ ਘਟਾਵੇ ਹੋ.

ਪਾਲਕ ਓਮੇਲੇਟ

ਬਨਾਵਵਾਨੀ ਰੀਤ

- 1 ਕਪ ਪਾਲਕਨੇ ਘੋਈਨੇ ਬਲੇਨ੍ਚ ਕਰੋ (ਤੇਨੇ ਉਕਲਤਾ ਪਾਣੀਮਾਂ 2 ਮਿਨਿਟ ਮਾਟੇ ਰਾਖੋ).
- 2 ਇੱਡਾਨੇ ਫਲਈ ਥਾਂਥ ਤਾਂ ਸੁਧੀ ਫੇਟੇ ਅਨੇ ਤੇਮਾਂ ਬਲੇਨ੍ਚ ਕਰੇਲੀ ਅਨੇ ਸਮਾਰੇਲੀ ਪਾਲਕ ਉਮੇਰੋ.
- ਇੱਡਾਨਾ ਮਿਸ਼੍ਰਣਮਾਂ 1 ਨਾਨੀ ਚਮਚੀ ਲਾਲ ਮਰਯੁ ਪਾਵਡਰ ਅਨੇ ਮੀਠੂ ਉਮੇਰੋ ਅਨੇ ਜਥਾਂ ਸੁਧੀ ਬਧੀ ਸਾਮਗ੍ਰੀ ਮਿਕਸ ਨ ਥਈ ਜਾਂਦੀ ਤਾਂ ਸੁਧੀ ਫੀਰੀ ਫੇਟੇ.
- ਏਕ ਪੇਨਮਾਂ 1 ਚਮਚੀ ਮਾਖਣਾ ਗਰਮ ਕਰੋ ਅਨੇ ਤੇਮਾਂ ਫੇਟੇਲਾ ਇੱਡਾਨੂੰ ਮਿਸ਼੍ਰਣ ਉਮੇਰੋ. ਸਮਾਨਤੁਪੇ ਫੇਲਾਵੀ ਅਨੇ 5-7 ਮਿਨਿਟ ਮਾਟੇ ਧੀਮੀ ਆਂਚ ਪਰ ਪਕਾਵੋ. ਫੇਰਵੀਨੇ ਬੀਜੂ ਬਾਜੂ ਪਾਣੀ ਪਕਾਵੋ.
- ਤੇਨੇ ਪ੍ਰੋਟੀਨਮਾਂ ਕਾਫੀਨੇ ਕੇਚਪ ਸਾਥੇ ਗਰਮ-ਗਰਮ ਪੀਰਸੋ.



ਪੋਖਰਾ ਮੂਲਕ (1 ਨਂਗਾ)

ਕੇਲਰੀ: 351 ਕੇਲਰੀ
ਚਰਬੀ: 14.7 ਗ੍ਰਾਮ
ਕਾਬੋਹਾਇਡ੍ਰੇਟਸ: 33.9 ਗ੍ਰਾਮ
ਪ੍ਰੋਟੀਨ: 20.7 ਗ੍ਰਾਮ

ਫਦਦ ਮਾਟੇ ਸ਼ਵਾਸਥਾ ਲਾਭੋ

- ਪ੍ਰੋਟੀਨ, ਫਾਇਬਰ, ਏਨਟੀਆਕਸਿਡੈਂਟ ਅਨੇ ਵਿਟਾਮਿਨਥੀ ਭਰਪੂਰ.
- ਵਧੁ ਪ੍ਰੋਟੀਨ ਲੇਵਾਥੀ ਇਵਸਲਰ ਭੂਮ ਨਿਯੰਤਰਣਮਾਂ ਰਹੇ ਹੋ.
- ਵਿਟਾਮਿਨ ਈ, ਈ, ਆਈਨ, ਮੇਝੇਸ਼ਿਯਮ ਅਨੇ ਫੋਲੇਟ ਜੇਵਾ ਫਦਦ-ਸ਼ਵਾਸਥ ਪੋਖਰ ਤਤਵੀ ਧਰਾਵੇ ਹੋ.



અહીં દક્ષિણ ભારતની કેટલીક સવારના નાસ્તાની વાનગીઓ છે

વજ ઓટસ ઉપમા



પોખરણ મૂલ્ય (100 ગ્રામ)

કેલરી: 214 કેલરી
ચરબી: 8 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ્સ: 31 ગ્રામ
પ્રોટીન: 7 ગ્રામ

બનાવવાની રીત

- એક કડાઈમાં 1 મોટી ચમચી તેલ ગરમ કરો અને તેમાં 1 નાની ચમચી રાઈ, $\frac{1}{2}$ નાની ચમચી અડદની દાળ, જુરું, મીઠો લીમડો અને 10 કાજુ ઉમેરો અને કાજુને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.
- 1 નાની ચમચી આફુ, 2 મરચાં, $\frac{1}{2}$ ઝંગળી અને 1 કપ સમારેલા શાકભાજુ (ગાજર, ફણસી, કેપિસ્કમ, વાણા), $\frac{1}{2}$ નાની ચમચી હળદર ઉમેરો અને નરમ થાય ત્યાં સુધી સાંતળો.
- 2 મોટી ચમચી પાણી ઉમેરો, ઢાંકીને 5 મિનિટ પકાવો.
- $\frac{1}{2}$ કપ પાણી, મીઠું અને 1 કપ શેકેલા ઓટસ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- જ્યાં સુધી ઓટસ સારી રીતે રંધાઈ ન જાય ત્યાં સુધી ઢાંકીને પકાવો. કોથેરથી સજાવીને ગરમા-ગરમ પીરસો.

હદય માટે સ્વાસ્થ્ય લાભો

- એન્ટીઓકિસડન્ટ અને ગ્રાવ્ય ફાઇબરથી ભરપૂર, તેથી, ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.
- મેઝશિયમ, ફોસ્ફરસ અને વિટામિન બી.1 થી ભરપૂર છે, જે હદય માટે ફાયદાકારક છે.

ઝંગળી અને જુવારની રોટલી

બનાવવાની રીત

- એક વાસણમાં 1 કપ જુવારનો લોટ લો અને તેમાં $\frac{1}{2}$ કપ જીણી સમારેલી ઝંગળી, 1 ચમચી મરચું, હળદર, ધાણા પાવડર, 1 નાની ચમચી તેલ, મીઠું અને જુરું ઉમેરો.
- સારી રીતે મિક્સ કરો અને થોડું-થોડું ગરમ પાણી ઉમેરીને નરમ લોટ બાંધો.
- કણકના નાના-નાના ગોળા બનાવો અને નાની રોટલી બનાવો.
- રોટલીને ગરમ તેલવાળા તવા પર મધ્યમ તાપ પર બે મિનિટ સુધી શેકો.
- બીજુ બાજુ કેરવો અને ચારે બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધો.

હદય માટે સ્વાસ્થ્ય લાભો

- આરન્ન અને મેઝશિયમથી ભરપૂર છે, જેનાથી કેલ્વિયમનું વધુ સારી રીતે શોખણ થાય છે.
- ઉચ્ચ ગુણવત્તાની પ્રોટીન અને ફાઇબર ધરાવે છે, જે પેટને લાંબા સમય સુધી બરેલું રાખે છે અને બિનઅસોગ્યપ્રદ ખાય પદાર્થોની છચ્છાને અટકાવે છે.



પોખરણ મૂલ્ય (1 રોટલી)

કેલરી: 49 કેલરી
ચરબી: 0.3 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ્સ: 10.2 ગ્રામ
પ્રોટીન: 1.5 ગ્રામ

બ્રાઉન ચોખાના ઢોસા સાથે નાળિયેરની ચટણી



પોષણ મૂલ્ય (1 નંગા)

કેલરી: 91.04 કેલરી
ચરબી: 1.53 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ્સ: 16.7 ગ્રામ
પ્રોટીન: 2.65 ગ્રામ

બનાવવાની રીત

- 2 કપ બ્રાઉન ચોખા, 1 કપ અડદની દાળ અને 1 ચમચી મેથીના દાણાને ધોઈને 6-8 કલાક અથવા આખી રાત પલાળી રાખો. પલાળ્યા પછી, બધી સામગ્રીને એકસાથે લીસું પીસી લો. તેને ઓરડાના તાપમાને 9-10 કલાક માટે આથી આવવા માટે રાખો.
- ઢોસા બનાવવા માટે: મધ્યમ ગરમ તવા પર એક મોટો ચમચો ખીંચું મૂકો અને તેને સરખા કરુના ઢોસા બનાવવા માટે ગોળ ગતિમાં કેલાવો. તેના પર 1 ચમચી તેલ લગાવો, 1-2 મિનિટ ધીમી આંચ પર રંધો અને પછી આગ વધારવી, અને બ્રાઉન/ગોલ્ડન થાય ત્યાં સુધી થોડીવાર પકાવો. ઢોસાને નારિયેળની ચટણી સાથે પીરસો.
- નારિયેળની ચટણી માટે: $\frac{1}{2}$ કપ તાજું ધીશેલું નારિયેળ, 2 સમારેલા લીલા મરચાં, 2 લસણની કળી, 2 ચમચી શેકેલી ચણાની દાળ અને મીઠું નાખીને પીસી લો.

હદ્ય માટે સ્વાસ્થ્ય લાભો

- ફાઈબર અને મેઝેશિયમથી ભરપૂર, જે હદ્ય રોગ અને સ્ટ્રોક સામે રક્ષણ આપે છે.
- વધુ ફાયબરને કારણે પાચન સ્વાસ્થ્ય સુધારે છે.
- કોલેસ્ટ્રોલના સતરને નિયંત્રિત કરે છે અને અનિદ્રામાંથી રહૃત આપે છે.

અહીં પૂર્વ ભારતની કેટલીક પ્રભ્યાત સવારના નાસ્તાની વાનગીઓ છે

બકવીટ (કુદુ) પેનકેક

બનાવવાની રીત

- એક નાનો બાઉલ લો, તેમાં 2 કપ કુદુનો લોટ, મીઠું, લીલા મરચાં અને સમારેલી કોથમીર સ્વાદ મુજબ લો.
- થોડું પાણી ઉમેરીને ગણા વગરનું ખીંચું બનાવો અને તેને 15 મિનિટ માટે બાજુ પર રાખો.
- પેન ગરમ કરો અને પેનની મધ્યમાં થોડું ખીંચું રેડો. તેને ચમચી વડે ડિનારીઓ પર કેલાવો.
- ધીમી આંચ પર શેકો અને તેને પલટાવો અને બીજી બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
- રાયતા અથવા ચટણી સાથે પીરસો.

હદ્ય માટે સ્વાસ્થ્ય લાભો

- પ્રોટીન, ફાઈબર અને તંદુરસ્ત જટિલ કાર્બોહાઇડ્રેટ્સનો સારો ખોત.
- નિયમિત લોટ માટે જ્યુટન-ડી વિકલ્પ.



પોષણ મૂલ્ય (4 નંગા)

કેલરી: 196 કેલરી
ચરબી: 5.8 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ્સ: 25.7 ગ્રામ
પ્રોટીન: 9.1 ગ્રામ

દાલ પીઠા



બનાવવાની રીત

- કણક માટે: ½ કપ ચોખાને આખી રાત પલાળી રાખો અને તેની પેસ્ટ બનાવી લો. પાણી ઉમરી પાતણું ખીડું બનાવો અને તેમાં મીઠું અને થીડું તેલ ઉમરો. નરમ કણક બને ત્યાં સુધી ધીમા તાપે બારે તળીયાવળા પેનમાં પકાવો.
- પૂરણ માટે: ચણાની દાળને 3-4 કલાક પલાળી રાખો અને તેમાં લીલા મરયાં, આદુ, લસણ, મીઠું, અજમો, જીડું અને કાળા મરી નાખીને અધકયડું વાટો. મસૂરની દાળના મિશ્રણને એક નાની ચમચી તેલમાં ધીમી આંચ પર જ્યાં સુધી કોડું ન થાય ત્યાં સુધી શેકો. હંડુ કરો અને સમારેલી કોથમીર ઉમરો.
- પીઠા બનાવવા માટે: ચોખાના લોટમાંથી લીબુના કદના ગોળા બનાવો. મસૂરને કપ જેવો આકાર બનાવો અને ખૂણા વાળો અને તેમાં દાળનું પૂરણ ભરો. છેડાને તેલવાળી આંગળીઓ વડે હળવેથી ચપટી લઇને બંધ કરો. પીઠાને ધીથી ગ્રીસ કરેલા સ્ટીમરમાં મૂકો અને તેને 8-10 મિનિટ સ્ટીમ કરો. તમે તેને ઉકળતા ગરમ પાણીમાં પણ મૂકી શકો છો અને જ્યાં સુધી તે સપાટી પર ન આવે ત્યાં સુધી રંધો.
- ચટણી અથવા ચટણી સાથે ગરમા-ગરમ પીરસો.

પોષણ મૂલ્ય (4 નંગા)

કેલરી: 150 કેલરી
ચરબી: 0.5 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ્સ: 28 ગ્રામ
પ્રોટીન: 6 ગ્રામ

હદ્ય માટે સ્વાસ્થ્ય લાલો

- વિટામિન B1, B9 અને E સમૃદ્ધ છે, જે રોગપ્રતિકારક શક્તિ, ત્વચાની તંદુરસ્તી, ઊર્જા પ્રદાન કરે છે, કોષોને પુનર્જીવિત કરવામાં મદદ કરે છે અને કેન્સરનું જોખમ ઘરાડે છે.
- તે બાફવામાં આવે છે, તેથી તે તેના મોટાભાગના મૂળ પોષક તત્વોને જાળવી રાખે છે, તેથી તે દીખમુક્ત નાસ્તા તરીકે સેવા આપે છે.

કુર્ટ પોરીજ

બનાવવાની રીત

- કડાઈમાં 4 ચમચી ઓટ્સ, 1 કપ દ્રિધ અને ½ કપ પાણી ઉમરો અને મિક્સ કરો.
- ધીમી આંચ પર 5 મિનિટ રાંધતી વખતે હલાવતા રહો.
- આંચ પરથી ઉતારી લો અને સ્વાદ પ્રમાણે એક ચમચી મધ્ય અથવા ખાંડ ઉમરો.
- પીરસતી વખતે ઉપરથી જીણા સમારેલા મોસમી ફળોના ટકડા, ફ્રાય ફૂટ્સ અને દાડમના દાણા ઉમરો.

હદ્ય માટે સ્વાસ્થ્ય લાલો

- કાર્બોહાઇડ્રેટ્સ, ફાઇબર, પ્રોટીન-દ્વાર્ય ચરબી અને એન્ટીઑડિસન્ટથી ભરપૂર, જે કુલ અને એલડીએલ કોલેસ્ટ્રોલ બંને ઘટાડીને હદ્ય રોગનું જોખમ ઘરાડે છે.
- કોલેસ્ટ્રોલ અને રક્ત શક્કરાનું સ્તર ઘરાડે છે, સ્વસ્થ આંતરડાના બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે અને પેટ બરેલું હોય તેવી અનુભૂતી થાય છે.
- ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરે છે અને લોહીમાં શક્કરાના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે.



પોષણ મૂલ્ય (150 ગ્રામ)

કેલરી: 52 કેલરી
ચરબી: 7.9 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ્સ: 47.8 ગ્રામ
પ્રોટીન: 13.4 ગ્રામ

પશ્ચિમ ભારતની કેટલીક પ્રખ્યાત સવારના નાસ્તાની વાનગીઓ નીચે મુજબ છે

બાજરીના પુડલા



પોષણ મૂલ્ય (2 નંગ)

કેલરી: 206 કેલરી

ચરબી: 4 ગ્રામ

કાર્બોહાઇડ્રેટ્સ: 37 ગ્રામ

પ્રોટીન: 7 ગ્રામ

બનાવવાની રીત

- એક બાઉલમાં $\frac{1}{2}$ કપ બાજરીનો લોટ, 1 કપ ધીંધેલું ગાજર અને કાકડી, લીલા મરચાં, 1 નાની કુંગળી, હળદર પાવડર, કાળા મરી પાવડર, જીરું અને લીલા ધાણા લો.
- થોડું પાણી ઉમેરીને ગણા વગરનું ખીરું બનાવો અને તેને 15 મિનિટ માટે બાજુ પર રાખો.
- પેન ગરમ કરો અને પેનની મધ્યમાં થોડું ખીરું રેડો. તેને ચમચી વડે કિનારીઓ પર કેલાવો.
- ધીમી આંચ પર પકાવો અને તેને પલટાવો અને બીજું બાજુ ગોલન બ્રાઉન થાય ત્યાં સુધી રેડો.
- રાયતા અથવા ચટણી સાથે પીરસો.

હદ્ય માટે સ્વાસ્થ્ય લાભો

- વિટામિન B, કેલ્ચિયમ, આર્યન, પોટેશિયમ, મેઝેશિયમ અને જીકથી ભરપૂર.
- પ્રકાર 2 ડાયાબિટીસ ઘટાડવામાં મદદ કરે છે અને હદ્ય રોગનું જોખમ ઘટાડે છે.

થાલીપીઠ

બનાવવાની રીત

- $\frac{1}{4}$ કપ જુવાર, ચણા, આખા ઘઉં, બાજરી, યોખાનો લોટ મિક્સ કરો તેમાં સમારેલી કુંગળી, મરચાં, આદુ, અજમો અને તલ ઉમેરો.
- થોડું થોડું પાણી ઉમેરી ફીલી કણક બનાવો.
- કણકનો નાનો ભાગો લો અને તેલવાળા તવા પર ધીમા તાપે ચપટી કરો.
- ચપટી કણક પર થોડા કાણાં કરો અને તેના પર થોડું તેલ લગાવો.
- ફાંકણ વડે ફાંકીને થાલીપીઠને 2 થી 3 મિનિટ સુધી અથવા નીચેથી ગોલન અને કડક થાય ત્યાં સુધી રહેવા દી. કેરવીને બીજું બાજુ પણ રાંધ્યો.
- ચટણી અથવા રાયતા સાથે ગરમાગરમ પીરસો.

હદ્ય માટે સ્વાસ્થ્ય લાભો

- પ્રોટીન આર્યન, ફાઈબર અને શેલિક એસિડનો ભરપૂર ખોત.
- તે જટિલ કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર છે તેથી પાચનને વધારે છે.



પોષણ મૂલ્ય (1 નંગ)

કેલરી: 88 કેલરી

ચરબી: 2.1 ગ્રામ

કાર્બોહાઇડ્રેટ્સ: 14.1 ગ્રામ

પ્રોટીન: 3.2 ગ્રામ

વेजुटेबल पौंआ



બનાવવાની રીત

- 1 કપ પૌંઆને પાણીથી ધોઈને બાજુ પર રાખો.
- એક કડાઈમાં તેલ ગરમ કરો, તેમાં રાઇ, વરિયાળી, 2 ચમચી શીગદાણા નાભીને સારી રીતે સાંતળો.
- 1 સમારેલી ઝુગળી ઉમેરો અને તે નરમ થાય ત્યાં સુધી પકાવો. ત્યાર બાદ તેમાં 1 કપ સમારેલા શાકભાજુ (ગાજર, કેપસિકમ, ટામેટો અને વટાણા) ઉમેરી 2-3 મિનિટ સુધી ધીમા તાપે રાંધી લો.
- મીઠી લીમડો, લીલા મરચાં, મીઠું, લાલ મરચું પાવડર, હળદર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- પૌંઆ ઉમેરો અને બધું બરાબર મિક્સ ન થાય ત્યાં સુધી હલાવો.
- સમારેલી કોથમીરથી સજાવીને ગરમાગરમ પીરસો.

પોષણ મૂલ્ય (150 ગ્રામ)

કેલરી: 130 કેલરી
ચરબી: 1.5 ગ્રામ
કાર્બોહાઇડ્રાટ્સ: 27 ગ્રામ
પ્રોટીન: 2.6 ગ્રામ

હદય માટે સ્વાસ્થ્ય લાભો

- તંદુરસ્ત કાર્બોહાઇડ્રાટ્સથી ભરપૂર જે શરીરને તેની ઈનિક પ્રવૃત્તિઓ કરવા માટે ઉજ્જી આપે છે.
- ફાઇબર, આયર્ન, વિટામિન્સ અને અન્ય પોષક તત્ત્વોથી ભરપૂર છે, તેથી તેને પૌંછિક ખોરાક માનવામાં આવે છે.
- કાર્બોહાઇડ્રાટ્સ સહિત આવશ્યક પોષક તત્ત્વો ધરાવે છે



બપોરનું ભોજન

- શરીરને શક્તિ આપે છે અને ઊર્જાનો સંચાર કરે છે.
- ચયાપથય સહિત રાખે છે.
- ભોજન વચ્ચે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.
- બપોરનું ભોજન ન લેવાથી પછીથી વધુ ભૂખ લાગી શકે છે, જે વધુ પડતું ખાવું અથવા ઓછા પોષણ મૂલ્યવાળા ખોરાકની પસંદગી તરફ દોરી શકે છે.



અહીં ઉત્તર ભારતની કેટલીક બપોરના ભોજનની વાનગીઓ છે.

રાગીની રોટલી



બનાવવાની રીત

- એક બાઉલમાં 1 કપ રાગીનો લોટ, 1 કપ ચોખાનો લોટ, 1 મોટી ચમચી શેકેલા ચણાનો લોટ, 2 ચમચી મીઠું અને 1 ચમચી તેલ મિક્સ કરો.
- 1 કપ બારીક સમારેલી કુંગળી, 2 બારીક સમારેલા લીલા મરચા અને લીલા ધાણા ઉમેરો.
- થોડું થોડું ગરમ પાણી લઈ કણક બાંધો.
- કણક માંથી નાના ગોળા બનાવો. એક ગોળો લો અને તેને ભીના કપડા પર ફેલાવો.
- કપડાને ગરમ 'તવા' પર ઉંઘો મૂકો અને કાળજીપૂર્વક કાપડાને ફૂર કરો.
- ચારેબાજુ તેલ લગાવો અને તેને બંને બાજુ ફેરવીને સારી રીતે પકાવો.

પોષણ મૂલ્ય (પ્રતિ નંગ)

કેલરી: 107 કેલરી

ચરબી: 4.4 ગ્રામ

કાર્બોહાઇડ્રેટ્સ: 15 ગ્રામ

પ્રોટીન: 2.1 ગ્રામ



હાય માટે સ્વાસ્થ્ય લાભો

- રાગી સીરમ ટ્રાઇઅલિસેરાઇડ્સની સાંક્રતા ઘટાડે છે અને લિપિડ ઓક્સિડેશન અને એલડીએલ ડોલેસ્ટ્રોલ ઓક્સિડેશનને અટકાવે છે. ઓક્સિડેશન, હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે.

વેજ ક્રિનોઓ અને દહીં



બનાવવાની રીત

- પ્રેશર ફુકરમાં તેલ ગરમ કરો અને તેમાં 1 નાની ચમચી જીડું ઉમેરો.
- 1 નાની ચમચી આદુ-લસણાની પેસ્ટ, $\frac{1}{2}$ કપ ઝંગળી, બારીક સમારેલા ગાજર, મકાઈ, કેપ્સિકમ અને ફણસી દરેક $\frac{1}{4}$ કપ ઉમેરો.
- મીઠું ઉમેરો અને એક મિનિટ માટે સાંતળો.
- હળદર પાવડર, મરયું પાવડર અને ગરમ મસાલો દરેક 1 ચમચી ઉમેરો. તેને એક મિનીટ સુધી ચડવા હો.
- શાકભાજુના મિશ્રણમાં 1 કપ ધોયેલા અને સાંતળોલા ક્રિનોઓ ઉમેરો.
- એક મિનિટ પકાવો, $1\frac{1}{2}$ કપ પાણી ઉમેરો, ઢાંકણ ઢાંકી હો અને 2 સીટી વગાડી પ્રેશર કુક કરો.
- ઠંડું કરો અને ઢાંકણ ખોલો, તેને ફોર્કથી મિક્સ કરો.
- લીબુનો રસ અને સમારેલી કોથમીર ઉમેરો અને દહીં સાથે ગરમા-ગરમ પીરસો.

પોષણ મૂલ્ય (150 ગ્રામ):

કેલરી: 150 કેલરી
ચરબી: 5.1 ગ્રામ
કાર્બોહાઇડ્રાટ્સ: 22.8 ગ્રામ
પ્રોટીન: 5.3 ગ્રામ

હદય માટે સ્વાસ્થ્ય લાભો

- આયર્નનો સારો સ્વોત, તંકુરસ્ત જોડાયેલી પેશીઓ અને સ્નાયુના ચચ્ચાપદ્ય માટે મદદરૂપ છે.
- ફોલેટ, મેઝેશિયમ અને ક્રેસેટિનનો સ્વોત જે ચેપ અને બળતરા સામે શરીરના સંરક્ષણને વધારવામાં મદદ કરે છે.

મૂંગ દાળ પુડલા અને કુદીનાની ચટણી

બનાવવાની રીત

- 2 કપ મગની દાળને ધોઈને 3 કલાક પલાણી રાખો.
- ગ્રાઇન્ડરમાં પલાણેલી દાળમાં 1 નાની ચમચી સમારેલું આદુ, 3 લીલા મરયાં, 1 નાની ચમચી જીડું, 1 નાની ચમચી હિંગ અને 1 નાની ચમચી મીઠું ઉમેરો અને તેને ઢોસાના ખીરાની જેમ પીસી લો.
- સમારેલી કોથમીર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- ઢોસાનો તવો ગરમ કરો. એક ચમચી જીડું નાખી અને ઢોસાની જેમ ડેલાવો.
- થોડું તેલ લગાવો, જ્યારે ઉપરનો રંગ બદલાઈ જાય, પછી તેને પલટાવો અને બીજુ બાજુથી પણ પકાવો. બંને બાજુથી રંધાઈ જાય પછી તેને તવામાંથી કાઢી લો. તૈયાર છે મગ દાળના પુડલા.
- કુદીનાની ચટણી માટે, 1 કપ કોથમીર, $\frac{1}{4}$ કપ કુદીનો, 1 નાની ચમચી જીણું સમારેલું આદુ, 3-4 લીલા મરયાં, $\frac{1}{2}$ ટામેટો, જીડું પાવડર, ધાણા પાવડર, સંચળ પાવડર, આમચૂર પાઉડર, દરેક $\frac{1}{2}$ ચમચી અને સ્વાદ અનુસાર મીઠું નાખીને પીસી લો.



હદય માટે સ્વાસ્થ્ય લાભો

- લોહીનું દબાણ ઘટાડવામાં મદદ કરે છે અને સ્નાયુના જેંચાણ સામે રક્ષણ આપે છે.
- ફોલેટ, ફાઈબર અને વિટામિન બીજી ધરાવે છે. બી-કોમ્પ્લેક્સ વિટામીનથી ભરપૂર.
- શરીરના ઇન્સ્યુલિન, રક્ત શર્કરા અને ચરબીના સ્તરને નીચે લાવવામાં મદદ કરે છે.

પોષણ મૂલ્ય (2 નંગા)

કેલરી: 121 કેલરી
ચરબી: 0.92 ગ્રામ
કાર્બોહાઇડ્રાટ્સ: 20.93 ગ્રામ
પ્રોટીન: 8.24 ગ્રામ

ચાલો દક્ષિણ ભારતની કેટલીક સૌથી લોકપ્રિય બપોરના ભોજનની વાનગીઓ પર એક નજર કરીએ

રાજી ઈડલી અને સંભાર



પોખણ મૂલ્ય (2 નંગ)

કેલરી: 70 કેલરી
ચરબી: 1.4 ગ્રામ
કાર્બોહાઇડ્રાટ્સ: 12.6 ગ્રામ
પ્રોટીન: 1.8 ગ્રામ

બનાવવાની રીત

- 1 કપ રાજીનો લોટ, $\frac{1}{4}$ કપ રવો, $\frac{2}{3}$ કપ દહી અને પાણી ઉમેરીને ઘણું બનાવો.
- 10-12 મિનિટ રહેવા દી.
- $\frac{1}{3}$ કપ ગાજર, $\frac{1}{2}$ નાની ચમચી હિંગ, થોડો મીઠો લીમડો અને રાઇને તેલમાં સાંતળો અને ખીરામાં ઉમેરો.
- $\frac{1}{2}$ પેકેટ ફુટ સોલ્ટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- ખીરાને ઈડલીના મોલડમાં રોડો અને 15 મિનિટ માટે વરાળથી પકાવો.
- સંભાર માટે, $\frac{1}{2}$ કપ તુવેર દાળને 2 કપ સમારેલા શાકભાજુ (દુગાળી, ટામેટા, ફણસી, સરગવો) સાથે ઉકાળો. તેમાં હિંગ, મીઠો લીમડો અને સંભાર મસાલો ઉમેરો.
- રાજી ઈડલીને ગરમ સંભાર સાથે પીરસો.

હદય માટે સ્વાસ્થ્ય લાભો

- રાજીમાં જોવા મળતા એન્ટીઓક્સિડન્ટ્સ તમારા શરીરમાં તણાવ સામે લડે છે જે વૃદ્ધાવસ્થાના સંકેતોને દ્રાર કરવામાં મદદ કરે છે.
- કોઈપણ ચરબી અને કોલેસ્ટ્રોલ વિના ખૂબ જ ઓછી કેલરી તેને હદયના સ્વાસ્થ્ય માટે આદર્શી બનાવે છે.

લેમન રાઇસ પુલાવ

બનાવવાની રીત

- એક કડાઈમાં 2 મોટી ચમચી તેલ ગરમ કરો અને તેમાં ચણાની દાળ, કાળી અડદની દાળ, સીંગદાળા, મેથીના દાઢા, સરસવના દાઢા, દરેક 1 નાની ચમચી અને $\frac{1}{4}$ કપ નારિયેળના ટુકડા નાખીને સુગંધિત થાય ત્યાં સુધી સાંતળો.
- 4-5 મીઠા લીમડાની દાંડી ઉમેરો અને મિક્સ કરો.
- 1 કપ બાફેલા શાકભાજુ જેમ કે ફલાવર, ગાજર અને ફણસી ઉમેરો અને મિક્સ કરો.
- 3 કપ રંધેલા ચોખા, મીઠું, 3 મોટી ચમચી લીંબુનો રસ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- લીંબુને પાતળા સ્લાઇસમાં કાપીને તપેલીમાં મૂકો. મિક્સ કરો અને 5 મિનિટ માટે ફાંકી દો.
- કોથમીરથી સજાવીને ગરમા-ગરમ પીરસો.



હદય માટે સ્વાસ્થ્ય લાભો

- વિટામિન સીનો ભરપૂર ખોત અને સ્ટ્રોક અને અન્ય હદય રોગના જોખમને ઘટાડીને હદયના સ્વાસ્થ્યને વધારે છે.
- ઉચ્ચ પોટેશિયમ અને ઓછી સોડિયમ તેને લોહીના દબાણ ને નિયંત્રિત કરવામાં અસરકારક બનાવે છે.

પોખણ મૂલ્ય (100 ગ્રામ):

કેલરી: 225 કેલરી
ચરબી: 5.6 ગ્રામ
કાર્બોહાઇડ્રાટ્સ: 37.3 ગ્રામ
પ્રોટીન: 5.1 ગ્રામ



જુવારના ઢોસા અને આદુ લસણાની ચટણી



બનાવવાની રીત

- એક બાઉલમાં 1 કપ જુવારનો લોટ, $\frac{1}{2}$ કપ ચોમાનો લોટ, 1 ચમચી મીઠું અને $2\frac{1}{2}$ કપ પાણી ઉમેરો. સારી રીતે હરાવવું જેથી કોઈ ગણો ન રહે.
- 1 કપ બારીક સમારેલી ઝુગળી, 2 લીલા મરચાં, ધાણાજીનું, મીઠો લીમડો અને 1 ચમચી છીણેલું આદુ, 1 નાની ચમચી જુડું અને કાળા મરી ઉમેરો.
- સારી રીતે મિક્સ કરો અને ઓછામાં ઓછા 30 મિનિટ માટે છોડી દો.
- એક નોન-સ્ટીક તવાને ગરમ કરો અને તેમાં એક ચમચી બેટર નાખીને પાતળું પડ બનાવો.
- થોડું તેલ લગાવો અને જુવારના ઢોસાને તેજ આંચ પર ડિસ્પો અને ગોલ્ડન થાય ત્યાં સુધી પકાવો.
- ચટણી માટે, લસણાની 10 કળી, 2 ઠંચ આદુ, 6-7 સૂકા લાલ મરચાં, 1 ચમચી જુડું અને મીઠું ઉમેરો. $\frac{1}{2}$ લીબુનો રસ નીચોવીને પીસી લો અને ગરમાગરમ ઢોસા સાથે પીરસો.

પોષણ મૂલ્ય (1 ઢોસો):

કેલરી: 80 કેલરી
ચરબી: 0.8 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ્સ: 16 ગ્રામ
પ્રોટીન: 3 ગ્રામ

હદય માટે સ્વાસ્થ્ય લાભો

- શરીરમાં કેલ્વિયમનું સ્તર જાળવી રાખે છે (મેન્જેશિયમ કેલ્વિયમના શોષણને વધારે છે) જેથી હાડકાના સ્વાસ્થ્યમાં સુધ્ધારો થાય છે.
- તેમાં બી વિટામિન્સ હોય છે, જે શરીરને નવા પેશીઓ અને કોષો બનાવવામાં મદદ કરે છે, અને પોટેશિયમ અને ફ્રોસ્કરસ, જે સ્વસ્થ હદયના કાર્યમાં મદદ કરે છે.

પૂર્વ ભારતની કેટલીક લોકપ્રિય બપોરના ભોજનની વાનગી અહીં છે.

ચોલર (ચણા) દાળ સાથે બ્રાઉન ભાત

બનાવવાની રીત

- 1 કપ ચણાની દાળને $2\frac{1}{2}$ કપ પાણી, $\frac{1}{2}$ નાની ચમચી હળદર અને $\frac{1}{4}$ નાની ચમચી મીઠું નાખીને નરમ થાય ત્યાં સુધી પ્રેશર કુક કરો.
- એક પેનમાં 2 મોટી ચમચી તેલ ગરમ કરો અને તેમાં જુડું, લવિંગ, લીલી ઈલાયચી અને તજ ઉમેરો. મસાલાની સુગંઘ ન આવે ત્યાં સુધી થોડી સેકડ માટે સાંતળો.
- લસણાની 4 કળી, 1.5 ઠંચ આદુ અને 1 લીલું મરયું વાટો અને તેને પેનમાં મૂકો.
- 1 કપ સમારેલી ઝુગળી ઉમેરો અને લગભગ 3 થી 4 મિનિટ સુધી નરમ થાય ત્યાં સુધી પકાવો.
- 1 કપ સમારેલા ટામેટો ઉમેરો, મિક્સ કરો અને નરમ થાય ત્યાં સુધી 5 મિનિટ પકાવો. ગરમ મસાલો, મરયું પાવડર, કસૂરી મેથી અને ધાણા પાવડર દરેક $\frac{1}{2}$ નાની ચમચી ઉમેરો.
- હવે એક કડાઈમાં $\frac{1}{2}$ કપ પાણીમાં બાડેલી ચણાની દાળ ઉમેરો અને તેને 5-7 મિનિટ સુધી ઉકળવા દો.
- 2 મોટી ચમચી ધી ગરમ કરીને અને તેમાં જુડું, સૂકા લાલ મરચાં અને 2 લસણાની કળી નાખીને વધાર તૈયાર કરો. તેને ગરમ દાળમાં નાખો.
- કોથમીરથી સજાવીને બ્રાઉન અથવા વ્હાઇટ ભાત સાથે ગરમાગરમ પીરસો.



પોષણ મૂલ્ય (50 ગ્રામ)

કેલરી: 180 કેલરી
ચરબી: 1 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ્સ: 32 ગ્રામ
પ્રોટીન: 11 ગ્રામ

હદય માટે સ્વાસ્થ્ય લાભો

- એન્ઝીઓકિસડન્ટોથી ભરપૂર છે જે બળતરા ઘટાડે છે અને હદયને સ્વસ્થ રાખે છે.
- શાકાહારીઓ માટે વનસ્પતિજ્ઞય પ્રોટીન અને પોષક તત્વોનો સારો સ્લોત.
- ખૂબ જ ઓછો ખ્યાલકેમિક ઇન્ડેક્સ (જુઆછ) જે તેને ડાયાબિટીસના દર્દીઓ માટે સારો વિકલ્પ બનાવે છે.
- પ્રોટીન જેનાથી પેટ બરેલું લાગે છે અને ભૂખને નિયંત્રિત કરે છે.

રોટલી સાથે કાળા ચણાની ધુગાણી



બનાવવાની રીત



- 2 કપ કાળા ચણાને ધોઈને આખી રાત અથવા 7 થી 8 કલાક પાણીમાં પલાણી રાખો.
- પ્રેશર ફુકરમાં 2 ચમચી સરસવનું તેલ ગરમ કરો અને તેમાં % નાની ચમચી જીરું, 1 તમાલપત્ર, 1 હેંચ તજ અને 2 લવિંગ ઉમેરો.
- 1½ કપ બારીક સમારેલી ઝુગળી ઉમેરો અને તે આછી ગુલાબી થાય ત્યાં સુધી સાંતતો.
- આ પછી ½ નાની ચમચી આદુ-લસણું પેસ્ટ ઉમેરો અને તેની કાચી ગંધ દર થાય ત્યાં સુધી શેડો. 1 કપ બારીક સમારેલા ટામેટાં ઉમેરો અને નરમ થાય ત્યાં સુધી પકાવો.
- સુધી મસાલો ઉમેરો - ½ નાની ચમચી હળદર પાવડર, ½ નાની ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જીરું પાવડર અને 1 ચમચી ધાણા પાવડર.
- પલાણેલા કાળા ચણા ઉમેરો અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરો. 2 કપ પાણી ઉમેરો, મીઠું નાખી પ્રેશર ફુકરમાં મધ્યમ આંચ પર 15 થી 20 મિનિટ સુધી અથવા ચણા બજાઈ જાય ત્યાં સુધી રાંધી લો.
- રાંધ્યા પઢી, ઢાંકણ ખોલો અને ગેવીને ઘણ થાય ત્યાં સુધી ધીમાથી મધ્યમ તાપ પર રાંધો અને તેમાં ½ નાની ચમચી ગરમ મસાલો ઉમેરો અને આંચ પરથી ઉતારી લો.
- પીરસવા માટે થોડી જીણી સમારેલી ઝુગળી, જીણી સમારેલી કોથમીર, બારીક સમારેલા

પોષણ મૂલ્ય (1 કપ)

કેલરી: 210 કેલરી
ચરબી: 3.8 ગ્રામ
કાર્બોહાઇડ્રાટસ: 35 ગ્રામ
પ્રોટીન: 10.7 ગ્રામ



બનાવવાની રીત

- વફુતમાં ચરબી અને કોલેસ્ટ્રોલ જમા થતા અટકાવે છે.
- વિટામિન બી6, સી, કોલેટ, નિયાસિન, ચિયામિન, રિબોફ્લેવિન અને મેગનીઝ, ક્રોસ્કરસ, આયર્ન અને ક્રોપર સહિતના ખનિજોનો સારો સોત છે, જે શરીરની કુદરતી રીગપ્રતિકારક શક્તિને વધારે છે.

રાગી રોટી સાથે દાલમા



બનાવવાની રીત

- મગા અને તુવેરની દાળ દરેક 1 કપ ધોઈને પાણીમાં 5-7 કલાક પલાણી રાખો.
- પલાણેલી દાળને પ્રેશર ફુકરમાં 15 મિનિટ સુધી પકાવો જ્યાં સુધી તે નરમ ન થાય.
- રાંધીલી દાળને એક પેનમાં મૂકો અને તેમાં 1 નાની ચમચી હળદર પાવડર અને 1 નાની ચમચી મીઠું ઉમેરો.
- નાના ટુકડા કરેલ સરગવો, કાચા કેળા, કોળું, બટેટા અને ફણસી દરેક ½ કપ ઉમેરો. શાકભાજી અડધા રંધાય ત્યાં સુધી ઢાંકિને પકાવો.
- રીંગણ ઉમેરો, ઢાંકિને 5 મિનિટ પકાવો. 1 કપ જીણી સમારેલા ટામેટાં ઉમેરો અને બધાં શાક બજાઈ જાય ત્યાં સુધી પકાવો.
- આંચ પરથી દર કરો અને બાજુ પર રાખો.



હદય માટે સ્વાસ્થ્ય લાભો

- પોટેશિયમનું ઊચું પ્રમાણ, જેનાથી સોડિયમની અસરોનો પ્રતિકાર કરીને લોહીનું દબાણ ઘટાડે છે.
- આયર્ન, જિંક, કોલેટ, સેલેનિયમ અને મેઝેશિયમથી ભરપૂર છે, જે હદયને સ્વસ્થ રાખે છે.
- ઝુકોઝનો ધીમો, સ્થિર સોત પ્રો પાડવા જટિલ કાર્બોહાઇડ્રાટસ અને પ્રોટીનનું સંતુલન ધરાવતો લો-ખાયકેમિક ઇન્ડેક્સ આહાર.

પોષણ મૂલ્ય (1 કપ)

કેલરી: 152 કેલરી
ચરબી: 2.57 ગ્રામ
કાર્બોહાઇડ્રાટસ: 29.69 ગ્રામ
પ્રોટીન: 4.75 ગ્રામ



પશ્ચિમ ભારતની કેટલીક લોકપ્રિય બપોરના ભોજનની વાનગીઓનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે

બાજરીની ખીચડી



પોષણ મૂલ્ય (150 ગ્રામ):

કેલરી: 252 કેલરી
ચરબી: 6.1 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ્સ: 38.2 ગ્રામ
પ્રોટીન: 11.3 ગ્રામ

બનાવવાની રીત

- ½ કપ બાજરી અને ¼ કપ આખી મગની દાળને અલગ-અલગ પાણીમાં 4 કલાક પલાણી રાખો.
- 4 કલાક પણી બાજરીને અધકચરી પીસી લો અને બાજુ પર રાખો.
- એક ફ્રકરમાં 2 મોટી ચમચી ધી ગરમ કરો અને તેમાં ½ નાની ચમચી જુડુ, ½ નાની ચમચી હિંગ, સમારેલું 1 આદુ અને 2 લીલા મરચાં ઉમરો અને 2 મિનિટ માટે સાંતળો.
- બાજરી ઉમરો અને 2 મિનિટ માટે સાંતળો અને પલાણેલી મગની દાળ ઉમરો
- 3 કપ પાણી, હળદર પાવડર અને મીઠું ઉમરો, સારી રીતે મિક્સ કરો અને 5 સીટી સુધી પ્રેશર ફુક કરો.
- રાંધ્યા પણી, તેને સારી રીતે મિક્સ કરો, થોડું વધુ ધી ઉમરો અને કોથમીરથી સજાવો.

હદ્ય માટે સ્વાસ્થ્ય લાભો

- ગ્રાવ્ય ફાઇબરનો ભરપૂર સ્વોત જે ધમનીઓમાં એલડીએલને જમા થતા અટકાવે છે.
- ફાઇબર, પોટેશિયમ અને મેઝેશિયમ લોહીના દબાણ ને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

બેસન કઢી

બનાવવાની રીત

- એક બાઉલમાં 1 ½ કપ દહી, 4 મોટી ચમચી ચણાનો લોટ, 1 નાની ચમચી લાલ મરચું પાવડર, 1 નાની ચમચી હળદર પાવડર અને મીઠું મિક્સ કરો. 2 કપ પાણી ઉમરો અને સારી રીતે હલાવો.
- એક કડાઈમાં ધી ગરમ કરો, તેમાં ½ નાની ચમચી જુડુ, મેથી અને હિંગ ઉમરો અને 2 મિનિટ માટે સાંતળો.
- મીઠો લીમડો અને બેટર ઉમરો અને તે ઉકોણો ત્યાં સુધી સતત હલાવતા રહો.
- જરૂર મુજબ પાણી ઉમરીને ઘણ બનાવો અને 15 થી 20 મિનિટ સુધી પકાવો.
- કોથમીરથી સજાવીને બાજરીના રોટલા કે ભાત સાથે પીરસો.



પોષણ મૂલ્ય (150 ગ્રામ):

કેલરી: 163 કેલરી
ચરબી: 11 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ્સ: 12 ગ્રામ
પ્રોટીન: 6 ગ્રામ

હદ્ય માટે સ્વાસ્થ્ય લાભો

- પોટેશિયમનું ઉચ્ચ પ્રમાણ, જે રક્ત વાહિનીઓનું વિસ્તરણ કરે છે, જે લોહીને વધુ સરળતાથી વહેવા દે છે અને એકંદરે લોહીનું દબાણ ઓછું કરે છે.
- બાજરીમાં ફાયબર પણ હોય છે જે એલડીએલ અથવા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.

વेजुटेबल स्ट्रू

बनावવानी रीत

- એક પેનમાં $\frac{1}{2}$ ચમચી નારિયેળ તેલ ગરમ કરો અને તેમાં 2 લવિંગ, 1 હિંદુ તજ અને 2 ઈલાયચી સાંતળો પછી તેમાં $\frac{1}{2}$ કુંગળી નાખીને તે નરમ થાય ત્યાં સુધી સાંતળો.
- કણસી, $\frac{1}{2}$ ગાજર, $\frac{1}{2}$ બટાકાના નાના ટુકડા, 3 મોટી ચમચી વટાણા, ફૂલકોબીના 10 ફૂલો, 2 લીલા મરચાં અને 1 હિંદુ આદુ ઉમેરો અને એક મિનિટ માટે સાંતળો.
- 1 કપ પાણી, 1 નાની ચમચી મીઠું અને થોડો મીઠો લીમડો ઉમેરો, સારી રીતે મિક્સ કરો, શાકભાજુ અધકચરા રંધાય ત્યાં સુધી ઢાંકીને ઉકાળો.
- 2 કપ પાતળું નારિયેળનું ફૂધ ઉમેરો અને 7 મિનિટ માટે ઉકાળો.
- ગેસ બંધ કરો અને $\frac{1}{2}$ કપ નારિયેળનું ઘણ ફૂધ ઉમેરો.
- સારી રીતે મિક્સ કરો અને વેજુટેબલ સ્ટ્રૂને ઇડિયપ્પમ અથવા અપ્પમ સાથે પીરસો.

હૃદય માટે સ્વાસ્થ્ય લાભો

- તે શરીરમાં જમા થયેલ કોલેસ્ટ્રોલ અને ચરબીને ઘટાડે છે, જેનાથી હાર્ટ એટેકની શક્યતાઓ ઓછી થાય છે.
- મેઝણિયમ, આયર્ન, લાઇકોપીન, પોટેશિયમ અને ફોસ્ફરસનો ભરપૂર સ્વોત છે, જે હૃદયના કાર્યને પ્રોત્સાહન આપે છે.



પોખરણ મૂલ્ય (150 ગ્રામ)

કેલરી: 184 કેલરી
ચરબી: 12.8 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ્સ: 15 ગ્રામ
પ્રોટીન: 1.8 ગ્રામ



સૂપ

- સૂપનો બાઉલ એ આહારમાં વધુ પોષક તત્વો ઉમેરવાની એક સરળ, ઝડપી અને સ્વાદિષ્ટ રીત છે.
- શાકભાજુના સૂપ અને સૂપમાં કેલરી અને ચરબી ઓછી હોય છે, તેમજ તેમાં વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર જીવા પોષક તત્વો હોય છે.
- વધુ શાકભાજુ ખાવા માટે સૂપ એ એક સરળ અને સ્વાદિષ્ટ રીત છે.
- સૂપમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર અને પ્રાકૃતિક ઘટકોને કારણે ધણા સ્વાસ્થ્ય લાભો છે.



અહીં કેટલીક લોકપ્રિય સૂપ બનાવવાની રીત છે.

ટામેટાનો સૂપ

બનાવવાની રીત



- એક પેનમાં, 1 ચમચી માખણ ગરમ કરો અને $\frac{1}{2}$ કુંગળી, લસણાની 2 કળી અને 1 તમાલપત્ર સાંતળો.
- 4 પાકેલા ટામેટાનું અને $\frac{1}{2}$ નાની ચમચી મીઠું ઉમેરો અને 5 મિનિટ માટે સાંતળો.
- 1 કપ પાણી ઉમેરો અને 10 મિનિટ અથવા ટામેટાનું નરમ અને એકરસ થાય ત્યાં સુધી ઉકાળો.
- તમાલપત્ર કાઢી નાખો, ઠંડુ કરો અને પાણી ઉમેર્યા વગર સ્મૃધ પેસ્ટ બનાવો.
- સૂપને ગાળીને ઉકાળો.
- 1 નાની ચમચી ખાંડ, $\frac{1}{2}$ નાની ચમચી કાળા મરી પાવડર અને $\frac{1}{4}$ નાની ચમચી સંચળ પાવડર (વૈકલ્પિક) મિક્સ કરો.
- કાઉટન્સ (તળોલી અથવા શેકેલી બેડના નાના ટુકડા) અને ધાણાના ટુકડાથી સજાવીને ગરમાગરમ પીરસો.

હદય માટે સ્વાસ્થ્ય લાભો

- ઓછી કેલરી અને પોટેશિયમ અને વિટામિન સી, કે અને એ ની માત્રા વધારે છે જે તેને હદય માટે અનુકૂળ બનાવે છે.
- લાઈકોપીન, ફલોનોઇડ્સ, વિટામિન સી અને ઇ, અને અન્ય એન્ટીઓક્સીડિન્ટ્સમાં વધારે છે.

પોષણ મૂલ્ય (175 મી.લી.)

કેલરી: 33 કેલરી

ચરબી: 0.4 ગ્રામ

કાર્બોહાઇડ્રાટ્સ: 7 ગ્રામ

પ્રોટીન: 1.6 ગ્રામ

મિક્સ વેજટેબલ સૂપ



બનાવવાની રીત

- એક પેનમાં 3 મોટી ચમચી તેલ ગરમ કરો અને તેમાં લસણાની 3 કળી, 1 હિંદુનાની આદુ અને 2 મોટી ચમચી લીલી કુંગળી સાંતળો.
- સમારેલા ગાજર, ફણસી, કેપ્સિકમ ઉમેરો અને એક મિનિટ માટે સાંતળો. ત્યાર ભાડા તેમાં કોણી, વટાણા, સ્વીટ કોરન નાખી હલકું શેકો.
- 4 કપ પાણી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. શાકભાજુ સારી રીતે રંધાઈ જાય ત્યાં સુધી ઉકાળો.
- 1 નાની ચમચી કોર્નફલોરમાં થોડું પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને ઉકાળતા સૂપમાં નાખો.
- સૂપ ઘણ થાય ત્યાં સુધી ઉકાળો. થોડું વિનેગર, મિક્સ હબ્સ, ચિલી ફલેક્સ અને કાળા મરી પાવડર ઉમેરો.
- લીલી કુંગળી અને કોથમીરની દાંડીથી સજાવી ગરમા-ગરમ પીરસો.

પોષણ મૂલ્ય (175 મી.લી.)

કેલરી: 57 કેલરી
ચરબી: 3.5 ગ્રામ
કાબોહાઇફ્રેટસ: 5.1 ગ્રામ
પ્રોટીન: 1.2 ગ્રામ

હદય માટે સ્વાસ્થ્ય લાભો

- મેઝનિશિયમ, આયર્ન, કેલ્વિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસનો ભરપૂર સ્લોત, જે હદયને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે.
- ઓછી કેલરી અને અસંતૃપ્ત ચરબી હોવાથી હદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

મસૂર અને ટામેટોનો સૂપ

બનાવવાની રીત

- લાલ મસૂરને રાતભર પાણીમાં પલાળી રાખો અને 15 મિનિટ ઉકાળો.
- એક મોટા તપેલામાં, 1 નાની ચમચી માખણ ગરમ કરો અને ગાજર, કુંગળી, લસણ અને બાંકેલી દાળને સાંતળો.
- શાકભાજુ અને દાળ નરમ થઈ જાય ત્યાં સુધી 15 મિનિટ ઢાંકીને ઉકાળો.
- ½ નાની ચમચી વિનેગર, મિક્સ હબ્સ, ચિલી ફલેક્સ, મીઠું અને મરી પાવડર ઉમેરો.
- કોથમીરથી સજાવીને ગરમા-ગરમ પીરસો.

હદય માટે સ્વાસ્થ્ય લાભો

- ફાઈબર, ફોલેટ અને પોટેશિયમથી ભરપૂર.
- આયર્ન અને વિટામીન બીનોનો સારો સ્લોત છે, જે ધબકારાને સ્થિર રાખવામાં મદદ કરે છે.



પોષણ મૂલ્ય (175 મી.લી.)

કેલરી: 81 કેલરી
ચરબી: 0 ગ્રામ
કાબોહાઇફ્રેટસ: 15.5 ગ્રામ
પ્રોટીન: 4.7 ગ્રામ

લીંબુ કોથમીરનો સૂપ



પોષણ મૂલ્ય (175 મિલી)

કેલરી: 67 કેલરી

ચરબી: 2.8 ગ્રામ

કાર્બોહાઇડ્રેટ્સ: 9.4 ગ્રામ

પ્રોટીન: 1.4 ગ્રામ

બનાવવાની રીત

- એક પેનમાં 3 નાની ચમચી તેલ ગરમ કરો અને તેમાં 2 લસણની કળી, 1 દિય આદુ, $\frac{1}{2}$ દુગળી અને 2 ચમચી કોથમીર 1 મિનિટ માટે સાંતળો.
- સમારેલા શાકભાજુ જેવા કે $\frac{1}{2}$ ગાજર, કોખી, કણસી, સ્વીટ કોર્ન ઉમેરો અને એક મિનિટ માટે સાંતળો.
- 3 કપ પાણી, મીઠું અને મરી પાવડર ઉમેરો અને તેને 15 મિનિટ સુધી ઉકાળો.
- 1 નાની ચમચી કોર્નફલોરમાં થોડું પાણી મિક્સ કરીને પેઝ બનાવો અને તેને ઉકળતા સૂપમાં નાખો.
- સૂપ ઘણ થાય ત્યાં સુધી ઉકાળો અને તેને આગ પરથી ઉતારી લો.
- 3 ચમચી લીલા ધાણા અને 2 ચમચી લીંબુનો રસ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- કોથમીરથી સજાવીને ગરમા-ગરમ પીરસો.

હદય માટે સ્વાસ્થ્ય લાભો

- એક ઉત્તમ મૂત્રવર્ધક પદાર્થ હોવાને કારણે, ધાણાનો અંક શરીરમાંથી વધારાનું સોડિયમ અને પાણી દૂર કરે છે.
- એચડીએલ (સારા) કોલેસ્ટ્રોલને વધારીને અને લોહીના દબાણ અને એલડીએલ (ખરાબ) કોલેસ્ટ્રોલને ઘટાડીને હદયનું રક્ષણ કરે છે.



રાત્રિભોજન

- તંકુરસ્ત અને હળવા રાત્રિભોજન શરીરને તેના સ્તરો અને કાર્યો જળવવામાં મદદ કરે છે.
- સ્વસ્થ આહાર સારી ઊંઘ, સવારનો નાસ્તો અને બપોરના ભોજનમાં સારી પસંદગીઓ, ઓછી બજારા, તણાવને નિયંત્રિત કરવાની ક્ષમતા, સારી પાચન, સ્થિર રક્ત ખાંડ અને ઓછી ચિંતા સાથે સંકળાયેલ છે.



 ઉત્તર ભારતની કેટલીક લોકપ્રિય રાત્રિભોજન વાનગીઓ નીચે મુજબ છે.

વેજટેબલ ખીયડી



પોષણ મૂલ્ય (1 કપ)

કેલરી: 328 કેલરી

ચરબી: 1 ગ્રામ

કાર્બોહાઇડ્રેટ્સ: 23 ગ્રામ

પ્રોટીન: 3 ગ્રામ

બનાવવાની રીત

- કુકરમાં 1 મોઢી ચમચી ધી ગરમ કરો અને તેમાં 1 તમાલપત્ર, 2 એલચી, 1 હંચ તજ, 3 લવિંગ, 1 નાની ચમચી જુદું અને એક ચપટી હિંગ નાંખો.
- 1 દુંગળી, 1 ઉભુ સમારેલું લીલું મરચું અને 1 નાની ચમચી આદુ લસણની પેસ્ટ અને 1 ટામેટો નરમ અને એકરસ થાય ત્યાં સુધી સાંતળો.
- 2 મોટી ચમચી વટાણા, $\frac{1}{4}$ ગાજર અને 2 મોટી ચમચી કેપ્સીકમ જેવા શાકભાજુ ઉમેરો. એક મિનિટ માટે સાંતળો.
- હવે તેમાં $\frac{1}{4}$ નાની ચમચી હણદર, $\frac{1}{4}$ નાની ચમચી મરચું પાવડર, $\frac{1}{4}$ નાની ચમચી ગરમ મસાલો અને 1 નાની ચમચી મીઠું ઉમેરીને ધીમી આંચ પર શેકો.
- $\frac{1}{2}$ કપ ચોખા અને $\frac{1}{2}$ કપ મગની દાળ ઉમેરો અને એક મિનિટ માટે ધીમી આંચ પર સારી રીતે મિક્સ કરો.
- હવે $3\frac{1}{4}$ કપ પાણી અને 2 ચમચી લીલા ધાણા ઉમેરો. સારી રીતે ભેળવી દો.
- ફાંકિને મધ્યમ તાપ પર 3 સીટી સુધી રંધો.
- વેજટેબલ મસાલા ખીયડીને દહી અને અથાણાં સાથે પીરસો.

હદય માટે સ્વાસ્થ્ય લાભો

- મસૂરની દાળમાં ભરપૂર માત્રામાં પોલિફીનોલ હોય છે, જે લોહીના દબાણ ને ઓછું કરવામાં મદદ કરે છે અને હદયના વિવિધ રોગોને અટકાવે છે.
- મસૂર તમારા રક્ત શર્કરા સ્તરને 20% થી વધુ ઘટાડી શકે છે.
- તે કાર્બોહાઇડ્રેટ્સ માટે તમારા શરીરના પ્રતિબાવમાં સુધારો કરે છે, અને તેથી ડાયાબિટીસ હોય તેવા લોકોને ફાયદો થાય છે.

દલિયા ખીચડી



બનાવવાની રીત

- એક મોટા બાઉલમાં $\frac{1}{2}$ કપ દલિયા અને $\frac{1}{2}$ કપ મગની દાળ લો અને પૂરતા પાણીમાં 30 મિનિટ પલાણી રાખો.
- એક પ્રેશર ફૂકરમાં 2 મોટી ચમચી ઘી લો અને તેમાં 1 નાની ચમચી રાઇ, 1 નાની ચમચી જુડું, એક ચપટી હિંગ, 1 સુંધર લાલ મરચું અને કેટલાક મીઠી લીમડો ઉમેરી સાંતળો.
- પલાણેલા દલિયા-મગની દાળને વધારમાં ઉમેરો અને 2 મિનિટ અથવા સુગંધ આવે ત્યાં સુધી સાંતળો.
- પછી તેમાં $\frac{1}{4}$ નાની ચમચી હળદર, $\frac{1}{4}$ નાની ચમચી મરચું પાવડર, $\frac{1}{2}$ નાની ચમચી ગરમ મસાલો અને $\frac{1}{2}$ નાની ચમચી મીઠું ઉમેરીને બરાબર સાંતળો.
- 1 ગાજર, $\frac{1}{2}$ બટાંકું, 2 મોટી ચમચી વટાણા, 1 ટામેટા અને $\frac{1}{2}$ નાની ચમચી આદુની પેસ્ટ ઉમેરો અને શાકભાજુ તૂટે નહીં તે રીતે એક મિનિટ માટે સાંતળો.
- 3 કપ પાણી ઉમેરો અને 3 સીટી વાગે અથવા દલિયા સંપૂર્ણ રીતે રંધાય ત્યાં સુધી પ્રેશર કુક કરો.
- ઠંડું કરો અને 2 મોટી ચમચી કોથમીર ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને પીરસો.

પોખણ મૂલ્ય (1 કપ)

કેલરી: 241 કેલરી

ચરબી: 11.2 ગ્રામ

કાર્બોહાઇડ્રાટ્સ: 4.57 ગ્રામ

પ્રોટીન: 29.76 ગ્રામ

હદય માટે સ્વાસ્થ્ય લાભો

- પોટેશિયમનો ભરપૂર સ્વોત, જે રક્ત નુકશાન ઘટાડવા અને લોહીના દબાણ ને સ્થિર કરવા માટે વાસોડાયાલેટર તરીકે કામ કરે છે. તેનાથી હદય પરનું દબાણ ઓઢું થાય છે.
- ડાયેટરી ફાઈબર કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત કરવામાં અને એથરોસ્ક્લેરોસિસને રોકવામાં મદદ કરી શકે છે.

પેન ગ્રીલ ચિકન ડાલિયા

બનાવવાની રીત

- 4 બોનલેસ ચિકન બ્રેસ્ટની બંને બાજુએ મીઠું અને મરી, 1 નાની ચમચી આદુલસણાની પેસ્ટ અને 1 નાની ચમચી લાલ મરચું પાવડર છાંટો.
- શાકભાજુ કાપો (1 ગાજર, 8-10 ફણસી, 1 બ્રોકોલી, 2-3 નાના ટામેટાં, 1 કુંગાળી અને 1 કેપ્સિકમ)
- એક કડાઈમાં ઓલિવ તેલ ગરમ કરો, ચિકન બ્રેસ્ટને ગરમ ગ્રીલ પર મુકો અને 4 થી 5 મિનિટ સુધી પકાવો.
- બીજુ બાજુ ફેરવો, ઢાંકી દો અને બીજુ 5 મિનિટ પકાવો. તેને આગ પરથી ઉતારી લો.
- એક કડાઈમાં 1 નાની ચમચી તેલ મુકો અને લસણાની 4 કળી ઝીણી સમારેલી ઉમેરો. સમારેલા શાકભાજુ ઉમેરો અને 4 મિનિટ સુધી ધીમા તાપે પકાવો. મીઠું અને મરી નાખો.
- ગરમ પેન ગ્રીલ ચિકનને શાકભાજુ સાથે પીરસો.



હદય માટે સ્વાસ્થ્ય લાભો

- ઉચ્ચ પ્રોટીન આહાર, જે તંદુરસ્ત વજન જાળવવામાં મદદ કરે છે, હદયની સમસ્યાઓ માટે જોખમી પરિબળોને સુધારે છે.
- વિટામીન બીટ ભરપૂર છે, જે હાઈ એટેકને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
- નિયાસિનનો સારો સ્વોત જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે, જે લદયરોગના વિકાસ માટે જોખમી પરિબળ છે.

પોખણ મૂલ્ય (100 ગ્રામ)

કેલરી: 237 કેલરી

ચરબી: 13.49 ગ્રામ

કાર્બોહાઇડ્રાટ્સ: 0 ગ્રામ

પ્રોટીન: 27.07 ગ્રામ

ચાલો દક્ષિણ ભારતની કેટલીક લોકપ્રિય રાત્રિભોજન વાનગીઓ પર એક નજર કરીએ.

વેજુટેબલ સંભાર



પોષણ મૂલ્ય (1 કપ)

કેલરી: 143 કેલરી

ચરબી: 5.4 ગ્રામ

કાર્બોહાઇડ્રાટ્સ: 18.4 ગ્રામ

પોટીન: 2.5 ગ્રામ

બનાવવાની રીત

- દાળને 20 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી રાખો અને 3 સીટીઓ સુધી પ્રેશર કુક કરો. 1 આમલીને પાણીમાં પલાળીને તેનો રસ કાઢો.
- શાકભાજુને ધોઈને કાપો ($\frac{1}{2}$ ગાજર, 4-5 મોટી ફણસી, $\frac{1}{2}$ નાનું ફલાવર, 1 બટાંકુ, 7-8 ફણસી, 1 રીગણ, 1 નાનું સંકેદ કોળું, $\frac{1}{4}$ દ્રધી) અને પ્રેશર કુક કરો.
- તેલ ગરમ કરો અને તેમાં 1 નાની ચમચી રાઠ ઉમેરો, ચટકવા લાગે ત્યારે, પછી તેમાં $\frac{1}{2}$ નાની ચમચી હિંગ, 1 નાની ચમચી લાલ મરચું, 1 નાની ચમચી મેથીના દાણા, થોડા લીમદાના પાન, 1 કપ સમારેલી ઝુગળી ઉમેરો અને થોડીવાર હલાવો.
- તેમાં આમલીનું પાણી, 1 નાની ચમચી હળદર પાવડર, મીઠું અને 1 મોટી ચમચી સંભાર પાવડર ઉમેરો.
- સંભારમાં રાંધેલા શાકભાજુ અને થોડું પાણી ઉમેરો.
- ઉકાળો અને સંભાર સહેજ ઘણ થાય ત્યાં સુધી બધું ઉકાળો.
- કોથમીરથી સજાવીને ગરમા-ગરમ પીરસો.

હદય માટે સ્વાસ્થ્ય લાભો

- ઉચ્ચ ફાઇબરવાળા ખોરાક હદય અને કોલેસ્ટ્રોલ માટે સારા છે.
- જીક, ચાયન, ડોલેટ અને મેઝેશિયમ જીવા એન્ટીઓકિસ્ડન્ટો અને વિટામિન્સ અને અનિજોમાં બધું હોય છે, જે હદયના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

કેરળ ફિશ કરી

બનાવવાની રીત

- 1 ઝુગળી, 1 ટામેટો, 6-8 કળી લસણ અને 3 લીલા મરચાની પેસ્ટ બનાવો.
- એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં $\frac{1}{2}$ કપ નારિયેળની પેસ્ટ નાખીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. $\frac{1}{2}$ નાની ચમચી મરચું પાવડર, $\frac{1}{2}$ નાની ચમચી હળદર પાવડર, 1 નાની ચમચી ધાણા પાવડર ઉમેરો અને લગભગ 3 મિનિટ સુધી પકાવો.
- બીજુ તપેલીમાં 1 મોટી ચમચી તેલ ગરમ કરો અને તેમાં 3 આખા લાલ મરચાં, થોડા મીઠો લીમડો અને 1 નાની ચમચી રાઠ અને 1 કપ ઝુગળીની પેસ્ટ ઉમેરો અને બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.
- રાંધેલ નારિયેળનો મસાલો, $\frac{1}{2}$ કપ આમલીનો રસ અને એક કપ પાણી ઉમેરો અને તેને ઉકાળો.
- 250 ગ્રામ માછલીના ટુકડા ઉમેરો અને લગભગ 10 મિનિટ માટે ઉકાળો.
- બાંદલા ભાત સાથે ગરમાગરમ પીરસો.



પોષણ મૂલ્ય (1 કપ)

કેલરી: 241 કેલરી

ચરબી: 11.2 ગ્રામ

કાર્બોહાઇડ્રાટ્સ: 4.57 ગ્રામ

પોટીન: 29.76 ગ્રામ

હદય માટે સ્વાસ્થ્ય લાભો

- ઓમેગા -3 ફેટી એસિડ્સનો એક મહત્વપૂર્ણ સ્નોત, જે લોહીના દબાણ ઘટાડીને અને અચાનક મૃત્યુ, હાઈ એટેક, અસામાન્ય હદય લય અને સ્ટ્રોકનું જોખમ ઘટાડીને તંદુરસ્ત હદયને જાળવવામાં મદદ કરે છે.
- "ખરાબ" એલડીએલના સતરો ઘટાડે છે, લોહીના દબાણ ઘટાડે છે અને 25%-30% ટ્રિગ્લિસરાઇડ્સનું સતર ઘટાડે છે.

સોયા ઉતપમ



બનાવવાની રીત

- 2 નાની ચમચી તેલ ગરમ કરો અને અડદની દાળ, ચણાની દાળ, સરસવના દાણા, હિંગ દરેક $\frac{1}{2}$ નાની ચમચી અને 15-20 લીમાડાના પાન; લગભગ એક મિનિટ માટે સાંતળો
- $\frac{1}{2}$ કપ સોયા ફિલેક્સ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. 2 કપ પાણી ઉમેરો અને ફિલેક્સ નરમ થાય ત્યાં સુધી પકાવો.
- તેને ગેસ પરથી ઉતારો, ઠંડુ કરો અને સોયા મિશ્રણમાં $\frac{1}{2}$ કપ ચોખાનો લોટ, $\frac{1}{2}$ કપ સોજુ, સ્વાદ અનુસાર મીઠું અને 1 કપ છાશ ઉમેરો; ઘણ ખીંડું બનાવવા માટે સારી રીતે મિક્સ કરો.
- અડધો કલાક ઢાંકીને રાખો.
- ગરમ તેલવાળા તવા પર એક ચમચી બેટર મૂકો; તેની ઉપર જીણી સમારેલી દુંગળી અને ગાજર ઉમેરો.
- ચારે બાજુ થોડું તેલ લગાવો અને ઢાંકીને મધ્યમ તાપ પર જ્યાં સુધી કિનારીઓ ઉચ્ચી થાય અને નીચેથી ગોલ્ડન ન થાય ત્યાં સુધી પકાવો.
- બીજુ બાજુ ફેરવીને રાંધો. દહોમાં સંચળ પાવડર, કાળા મરી અને સમારેલી કોથમીર ઉમેરીને પીરસો.

પોખણ મૂલ્ય (2 નંગા)

કેલરી: 104 કેલરી
ચરબી: 0.5 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ્સ: 18.5 ગ્રામ
પ્રોટીન: 8.75 ગ્રામ

હદય માટે સ્વાસ્થ્ય લાભો

- પોલીઅનસેચ્યુરેટેડ ચરબીનો સારો સ્લોત જે હદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, જેમ કે કોલેસ્ટ્રોલ ઘટવું.
- સોયા-આધ્યારિત પોરાકમાં ફાયટોક્મિકલ્સ અને ફાઈબર હોય છે જે સ્ટ્રોક અને કોરોનરી હદય રોગ સહિત હદય રોગના જોખમને ઘટાડે છે.



પૂર્વીય ભારતની કેટલીક લોકપ્રિય રાત્રિભોજન વાનગીઓ નીચે મુજબ છે

બ્રાઉન રાઇસ સાથે સુક્તો

બનાવવાની રીત

- હળદરના પાણીમાં 1 બટાકું, $\frac{1}{2}$ કાચા કેળા, 1 શક્કરિયું, 6 ફિલાસી, 1 સરગવો, 1 ગાજરના ટુકડા નાખો.
- એક પેનમાં સરસવનું તેલ ગરમ કરો અને તેમાં 2 ચમચી પંચફોરન મસાલો અને 2 નાની ચમચી આફની પેસ્ટ ઉમેરો. ગોલ્ડન થાય ત્યાં સુધી પકાવો.
- 1 ચમચી સરસવની પેસ્ટ, મરચું પાવડર અને હળદર ઉમેરો. તેલ અલગ ન થાય ત્યાં સુધી પકાવો.
- સમારેલા શાકબાજુ ઉમેરો અને 2 મિનિટ માટે સાંતળો.
- પાણી ઉમેરો અને શાકબાજુ નરમ થાય ત્યાં સુધી પકાવો.
- બાકેલા ભાત સાથે પીરસો.



હદય માટે સ્વાસ્થ્ય લાભો

- કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે, જે સ્વસ્થ હદયને જાળવવામાં મદદ કરે છે.
- કેલરી ઓછી છે પરંતુ ફાઈબર વધારે છે, તેથી ભરપૂર ભોજન છે.

પોખણ મૂલ્ય (1 કપ)

કેલરી: 281 કેલરી
ચરબી: 14 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ્સ: 35 ગ્રામ
પ્રોટીન: 5 ગ્રામ



માચેર જોલ (બંગાળી માછલી કરી)

બનાવવાની રીત



પોષણ મૂલ્ય (1 કપ)

કેલરી: 176.5 કેલરી
ચરબી: 8.2 ગ્રામ
કાર્બોહાઇડ્રાટ્સ: 17.5 ગ્રામ
પ્રોટીન: 7.8 ગ્રામ

- રોહુ અથવા કટલા માછલીને સાફ કરીને તેના નાના ટુકડા કરી લો, તેમાં 1 નાની ચમચી મીઠું અને હળદર પાવડર નાખીને 2 કલાક માટે મેરીનેટ કરવા માટે છોડી દો.
- એક પેનમાં તેલ ગરમ કરો, તેમાં માછલીના ટુકડાને તળી લો અને તેને બાજુ પર રાખો.
- એક પેનમાં 2 ચમચી સરસવનું તેલ ગરમ કરો અને તેમાં 1 નાની ચમચી જુડું, 1 તમાલપત્ર, 1 સમારેલું ટામેટું ઉમેરો અને તે નરમ થાય ત્યાં સુધી પકાવો.
- 2 નાની ચમચી આદુ-લસણની પેસ્ટ, 3 લીલા મરચાં, 1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને $\frac{1}{2}$ નાની ચમચી હળદર પાવડર ઉમેરો અને 5 મિનિટ માટે પકાવો.
- જરૂર મુજબ પાણી ઉમેરો અને તેને ઉકળવા દો.
- તળેલી માછલીના ટુકડા ઉમેરો અને તેને ધીમી આંચ પર 5 મિનિટ સુધી પકાવો.
- કોથમીરથી સજાવી ભાત સાથે પીરસો.

હદય માટે સ્વાસ્થ્ય લાભો

- તેમાં ઓમેગા 3 કેટી એસિડ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે, લોહીનું દબાણ ઓછું કરે છે અને સોજો ઘટાડે છે.
- માછલીમાં સંતૃપ્ત ચરબીની ગેરહાજરીને લીધે હદયની તંદુરસ્તી માટે ખૂબ ભલામણ કરવામાં આવે છે.

મિક્સ વેજુટેબલ કરી

બનાવવાની રીત

- 4 ચમચી તેલ ગરમ કરો અને 1 તમાલપત્ર, 1 ચમચી જુડું, 2 ચમચી કસૂરી મેથી ઉમેરી સાંતળો, 1 દુંગળી અને 1 નાની ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરો અને 5 મિનિટ પકાવો.
- $\frac{1}{6}$ નાની ચમચી હળદર, 1 નાની ચમચી લાલ મરચું પાવડર, 1 નાની ચમચી ધાણા પાવડર, $\frac{1}{2}$ નાની ચમચી ગરમ મસાલો અને 1 નાની ચમચી મીઠું ઉમેરીને સારી રીતે સાંતળો.
- 1 કપ ટમેટાની પ્યુરી ઉમેરો અને તેને સારી રીતે પકાવો.
- સમારેલા મિક્સ શાકભાજુ (1 બટાકું, $\frac{1}{2}$ ગાજર, $\frac{1}{2}$ કપ ઇલાવર, 4 ફણસી, $\frac{1}{4}$ કપ વટાણા, $\frac{1}{4}$ કેપ્સિકમ) ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- $\frac{1}{2}$ કપ પાણી ઉમેરો અને બીજી 10 મિનિટ પકાવો.
- ગેસ બંધ કરો અને 1 નાની ચમચી કસૂરી મેથી અને 2 મોટી ચમચી કોથમીર ઉમેરો. બરાબર મિક્સ કરો અને મિક્સ વેજુટેબલ કરી ને રોટલી સાથે ગરમાગરમ પીરસો.



પોષણ મૂલ્ય (1 કપ):

કેલરી: 188 કેલરી
ચરબી: 8.8 ગ્રામ
કાર્બોહાઇડ્રાટ્સ: 24 ગ્રામ
પ્રોટીન: 5.6 ગ્રામ

હદય માટે સ્વાસ્થ્ય લાભો

- એન્ટીઓક્સિડન્ટ અને ફાયટોકેમિકલ્સથી ભરપૂર છે જે સોજા સામે રક્ષણ કરવામાં મદદ કરે છે.
- શાકભાજુમાંથી પોટેશિયમ અને ફાઈબર મળે છે તે હદય રોગનું જોખમ ઘટાડે છે.



ચાલો પશ્ચિમ ભારતની કેટલીક સૌથી લોકપ્રિય રાત્રિબોજનની વાનગીઓ પર એક નજર કરીએ

જુવારની રોટલી સાથે ઉસલ



બનાવવાની રીત

ઉસલ માટે:

- 2 કપ આખા મઠ (મટકી)ને ધોઇને પલાળી રાખો અને તેને અંકુરિત થવા માટે રાખો.
- એક પેન ગરમ કરો અને ½ કપ છીણેલું સુંકું નાળિયેર બ્યાઉન થાય ત્યાં સુધી સાંતણો.
- 2 મોટી ચમચી તેલ ગરમ કરો અને તેમાં 8-10 લસણની કળી અને 2 ઈચ્છા આદુ નાખીને બ્યાઉન થાય ત્યાં સુધી સાંતણો. 1 કપ જીણી સમારેલી ઝુંગળી ઉમેરો અને બ્યાઉન થાય ત્યાં સુધી સાંતણો.
- શેકલું નાળિયેર અને ½ કપ કોથમીર ઉમેરો. મિક્સ કરો, ઠંડુ કરો અને પેસ્ટ બનાવો.
- એક પેનમાં 2 મોટી ચમચી તેલ ગરમ કરો અને તેમાં રાઠ, જુંબુ, કરી પત્તા, લીલા મરચાં 1 નાની ચમચી અને 1 ચપટી હિંગ ઉમેરો.
- 1 કપ સમારેલી ઝુંગળી ઉમેરો અને ઝુંગળી નરમ થાય ત્યાં સુધી સાંતણો.

- 1 નાની ચમચી હણદર પાવડર અને મસાલાની પેસ્ટ, લાલ મરચું પાવડર, ½ નાની ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરો અને મસાલમાંથી તેલ છૂટે ત્યાં સુધી પકાવો.
- કણગાવેલા મઠ, 1 ½ કપ પાણી, 1 કપ સમારેલા ટામેટો ઉમેરો અને 15 મિનિટ માટે ઉકાવો.
- કોથમીર અને સમારેલી ઝુંગળી વડે સજાવો.

જુવારની રોટલી માટે:

- એક બાઉલમાં ¾ કપ જુવારનો લોટ અને ½ કપ ઘઉનો લોટ અને એક ચપટી મીઠું નાખીને ગરમ પાણીથી નરમ લોટ બાંધો.
- કણકનો એક લીબુન કણો ગોળો લો અને ચપાતી બનાવો. તેને ગરમ તવા પર મડો અને તે અધકચરી થાય તે પહેલાં તરત જ તેને ફેરવો.
- 2 મિનિટ માટે રંધી અને ઝરીયી પલટાવો. ચપાતી ઝૂલી જાય એટલે તેને ઘંંય પરથી ઉતારી લો.

પોખરા મૂલ્ય (1 કપ)

કેલરી: 168 કેલરી
ચરબી: 5 ગ્રામ
કાર્બોહાઇડ્રાટ્સ: 21 ગ્રામ
પ્રોટીન: 8 ગ્રામ

હદય માટે સ્વાસ્થ્ય લાભો

- જુવારની રોટલીમાં રહેલા પોખક તલ્લો પ્લેટેલેટ્સને ઘદ થતા અટકાવે છે અને હાઈ એટેક, સ્ટ્રોક અને એથરોસ્ક્લેરોસિસનું જોખમ ઘટાડે છે.
- ફાઈબરથી ભરપૂર, તે એલીડીએલ (ખરાબ કોલેસ્ટ્રોલ) ઘટાડવામાં મદદ કરે છે અને સ્ટ્રોક સહિત હદયના રોગોની શક્યતા ઘટાડે છે.
- ઉસલમાં પોટેશિયમ, મેઞ્ચેશિયમ, આયરન અને કોપર જેવા ખનિજો ભરપૂર છે, જે હદયના સ્વાસ્થ્ય માટે શાયદાકારક છે.

સાંદા વરણ ભાત

બનાવવાની રીત

- 1 કપ તુયેર દાળને ધોઇને 30 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો.
- દાળને પ્રેશર ફૂકરમાં 1 ½ કપ પાણી, 1 ચમચી હણદર પાવડર અને 1 ચમચી ધી સાથે મૂકો.
- તેને મધ્યમ તાપ પર 3-4 સીટીઓ સુધી પકાવો, ઠંડુ કરો અને મેશ કરી નરમ બનાવો.
- એક નાની કડાઈમાં 2 મોટી ચમચી ધી ગરમ કરો અને તેમાં 1 નાની ચમચી રાઠ, 1 નાની ચમચી જુંબુ, 1 ચપટી હિંગ અને 2 લીલાં મરચાં ઉમેરો.
- રંધીલી દાળમાં તરત જ વધાર ઉમેરો.
- દાળમાં વધાર મિક્સ કરો અને ભાત સાથે પીરસો.

હદય માટે સ્વાસ્થ્ય લાભો

- પોટેશિયમથી ભરપૂર, જે રક્ત નુકશાન ઘટાડવા અને લોહીના દબાણ ને સ્થિર કરવા માટે વાસોડાયાલેટર તરીકે કામ કરે છે. તેનાથી હદય પરનું દબાણ ઓછું થાય છે.
- ડાયેટરી ફાઈબર કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત કરવામાં અને એથરોસ્ક્લેરોસિસને રોકવામાં મદદ કરે છે.



પોખરા મૂલ્ય (1 કપ)

કેલરી: 55 કેલરી
ચરબી: 2 ગ્રામ
કાર્બોહાઇડ્રાટ્સ: 6 ગ્રામ
પ્રોટીન: 2 ગ્રામ



એગ વિનાલુ



બનાવવાની રીત

- 4 ઈંડા ઉકાળો, છાલ કાઢો અને તેને લાંબા કાપો.
- 4 સ્રુકા લાલ મરચાં, 1 ઈંચ આદુ, 6-7 લસણની કળી, 2 નાની ચમચી જીડું, 1 ટજ, 2 નાની ચમચી વિનેગર અને સ્વાદ અનુસાર મીઠું નાખીને પીસી લો.
- એક પેનમાં 2 ચમચી ધી ગરમ કરો, દુંગળી ઉમેરો અને ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળો.
- પીસેલી પેસ્ટ, 1 નાની ચમચી ખાંડ, 1 નાની ચમચી ગરમ મસાલા પાવડર, બાફેલા ઈંડા ઉમેરો અને ગ્રેવી ઘણ થાય ત્યાં સુધી પકાવો.
- આદુની સમારેલી પાતળી ચીરીઓ અને કોથમીરથી સજાવો અને રોટલી કે ભાત સાથે પીરસો.

હદય માટે સ્વાસ્થ્ય લાભો

પોષણ મૂલ્ય (1 ઈંડ)

કેલરી: 104.7 કેલરી

ચરબી: 8.7 ગ્રામ

કાર્બોહાઇડ્રેટ્સ: 7 ગ્રામ

પોટીન: 1.7 ગ્રામ

- ફોલેટ, વિટામિન એ, વિટામિન બી5, વિટામિન બી12, વિટામિન ડી, વિટામિન બી2, વિટામિન થ, વિટામિન બી6, ઝોસ્ફરસ, સેલેનિયમ, જીક, પ્રોટીન, તંદુરસ્ત ચરબી, કોલિન અને કેલ્શિયમનો ભરપૂર સ્નોત, જે હદય રોગને રોકવામાં મદદ કરે છે..
- એચડીએલ કોલેસ્ટ્રોલ ઘરાવે છે, જે સ્ટ્રોકના જીખમને ઘટાડવામાં મદદ કરે છે.
- ઈંડાં ટ્રાઈલિસરાઈડ્સ ઘટાડવામાં મદદ કરે છે, તેમજ લોહીનું દબાણ ઓછું કરે છે અને હદયની અસામાન્ય લયની શક્યતા ઘટાડે છે.

અમારા ડાયેટિશિયનની સલાહ

સવારનો નાસ્તો, બપોરનું બોજન, સાંજનો નાસ્તો અને રાત્રિબોજન નિયમિતપણે ખાવાથી રક્ત શક્કરા નિયમિત અને સ્થિર રહે છે, તમને લાંબા સમય સુધી નિયમિત ઊર્જા મળે છે અને તમારા હદયને સ્વસ્થ રાખે છે. યોગ્ય ખાવું એટલે યોગ્ય સમયે સંતુલિત માત્રામાં તાજો, ઘરે બનાવેલો, પ્રકૃત્યા વિનાનો મોસમી ખોરાક ખાવો. એક બોજન ન લેવાથી પછીથી વધુ ભૂખ લાગી શકે છે અને વાસ્તવમાં, તમને એવા ખોરાકની છચ્છા થાય છે જેમાં ખાંડ કે કેલરીની માત્રા વધુ હોય છે. આને "ઉપવાસ અને બોજનની પેટર્ન"નો કેસ કહી શકાય, જેનાથી રક્ત શક્કરામાં વૃદ્ધિ અને વજન વધે છે અને જેનાથી હદયના સ્વાસ્થ્યને અસર થઈ શકે છે. તેના લીધે પેટનું ફૂલવું અને એસિડિટી થઈ શકે છે, તમને ભાર લાગે છે, જેનાથી તેનો હેતુ બગડે છે. તેથી, નિયમિતપણે તાજું રાંધેલું બોજન ખાવું અને સ્થિર રક્ત શક્કરા અને સ્વસ્થ વજન જાળવી રાખવું એ હદયના સારા સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે.



Dietitian: Ankita Gupta Sehgal

M.Sc in Food & Packaging Technology

B. Sc. (Hons) in Food Sciences

13 years of expertise in weight loss,

PCOD corrections & other therapeutic diets

Delhi NCR



For the Use of a Registered Medical Practitioner, Hospital, or a Laboratory only.



Designed and developed by:



Xenith
A Division of INTAS

Disclaimer: Conceptualized, Edited & Designed by AurumMedcom. Intas Pharmaceuticals Limited has not verified the scientific validity of the content or any associated copyright or intellectual property issue. The views expressed do not necessarily reflect those of the publisher or sponsor. The publication is not to be construed as any endorsement of the quality or value of the advertised/sponsored products described herein. Kindly be guided by your independent professional expertise in this regard. Any suggestions to improve this publication or to correct any inadvertent error (if any) may kindly be brought to our notice.